

Rev

Chapter 14

Gujarati Interlinear

Reference: American Standard Version

- 1 καὶ εἶδον, καὶ ἶδού, τὸ Ἄρνιον ἑστὸς ἐπὶ τὸ ὄρος Σιών, καὶ μετ’
अने मे-जोयुं अने जोओ ते धेदुं ठिभु-डनुं ઉપર તે પર્વત સિયોન અને સાથે
[G2532](#) [G3708](#) [G2532](#) [G3708](#) [G3588](#) [G0721](#) [G2476](#) [G1909](#) [G3588](#) [G3735](#) [G4622](#) [G2532](#) [G3326](#)
- αὐτοῦ ἑκατὸν τεσσεράκοντα τέσσαρες χιλιάδες, ἔχουσαι τὸ ὄνομα αὐτοῦ, καὶ
તેની સો-ચાળીસ ચાળીસ ચાર હજાર જેમના-હતાં તેનું નામ તેનું અને
[G0846](#) [G1540](#) [G5062](#) [G5064](#) [G5505](#) [G2192](#) [G3588](#) [G3686](#) [G0846](#) [G2532](#)
- τὸ ὄνομα τοῦ Πατρὸς αὐτοῦ, γεγραμμένον ἐπὶ τῶν μετώπων αὐτῶν.
તેનું નામ તેના પિતાનું તેના લખાયેલું ઉપર તેમના કપાળો તેમના
[G3588](#) [G3686](#) [G3588](#) [G3962](#) [G0846](#) [G1125](#) [G1909](#) [G3588](#) [G3359](#) [G0846](#)

And I saw, and behold, the Lamb standing on the mount Zion, and with him a hundred and forty and four thousand, having his name, and the name of his Father, written on their foreheads.

- 2 καὶ ἤκουσα φωνήν ἐκ τοῦ οὐρανοῦ, ὡς φωνήν ὑδάτων πολλῶν, καὶ
अने मे-सांलथो अवाज मांथी ते आकाशमांथी જેવો અવાજ પાણીનો પુષ્કળ અને
[G2532](#) [G0191](#) [G5456](#) [G1537](#) [G3588](#) [G3772](#) [G5613](#) [G5456](#) [G5204](#) [G4183](#) [G2532](#)
- ὡς φωνήν βροντῆς μεγάλης, καὶ ἡ φωνή ἦν ἤκουσα, ὡς κίθαριζόντων
જેવો અવાજ ગરજનાનો મોટો અને તે અવાજ જે મે-સાંલથો જેવો વીણા-વગાડનારાનો
[G5613](#) [G5456](#) [G1027](#) [G3173](#) [G2532](#) [G3588](#) [G5456](#) [G3739](#) [G0191](#) [G5613](#) [G2790](#)
- κίθαριζόντων ἐν ταῖς κithάραις αὐτῶν.
વીણા-વગાડતાં વડે તેમની વીણાઓ તેમની
[G2789](#) [G1722](#) [G3588](#) [G2788](#) [G0846](#)

And I heard a voice from heaven, as the voice of many waters, and as the voice of a great thunder: and the voice which I heard was as the voice of harpers harping with their harps:

- 3 καὶ ᾄδουσιν ᾠδὴν καινὴν ἐνώπιον τοῦ θρόνου, καὶ ἐνώπιον τῶν
अने गाय-छे जाणो गीत नवुं समक्ष ते राज्यासननी अने समक्ष ते
[G2532](#) [G0103](#) [G5613](#) [G5603](#) [G2537](#) [G1799](#) [G3588](#) [G2362](#) [G2532](#) [G1799](#) [G3588](#)
- τεσσάρων ζώων, καὶ τῶν πρεσβυτέρων. καὶ οὐδείς ἐδύνατο μαθεῖν τὴν
ચાર પ્રાણીઓની અને તે વડીલોની અને કોઈ-નહોતું શક્યું-હતું શીખવા તે
[G5064](#) [G2226](#) [G2532](#) [G3588](#) [G4245](#) [G2532](#) [G3762](#) [G1410](#) [G3129](#) [G3588](#)
- ᾠδὴν, εἰ μὴ αἱ ἑκατὸν τεσσεράκοντα τέσσαρες χιλιάδες, οἱ
ગીત સિવાય કે તે સો-ચાળીસ ચાળીસ ચાર હજાર જેઓ
[G5603](#) [G1487](#) [G3361](#) [G3588](#) [G1540](#) [G5062](#) [G5064](#) [G5505](#) [G3588](#)
- ἠγορασμένοι ἀπὸ τῆς γῆς.
ખરીદાયેલા-હતા માંથી આ પૃથ્વીની
[G0059](#) [G0575](#) [G3588](#) [G1093](#)

and they sing as it were a new song before the throne, and before the four living creatures and the elders: and no man could learn the song save the hundred and forty and four thousand, even they that had been purchased out of the earth.

4 οὗτοί εἰσιν οἱ μετὰ γυναικῶν οὐκ ἐμολύνθησαν; παρθένοι γάρ εἰσιν. οὗτοι
 आओ छे जेओ साथे स्त्रीओनी नछोता अशुद्ध-थया कुंवाराओ जरेपर छे आओ
[G3778](#) [G1510](#) [G3739](#) [G3326](#) [G1135](#) [G3756](#) [G3435](#) [G3933](#) [G1063](#) [G1510](#) [G3778](#)

οἱ ἀκολουθοῦντες τῷ Ἄρνίῳ ὅπου ἂν ὑπάγη. οὗτοι ἠγοράσθησαν ἀπὸ
 जेओ अनुसरे-छे ते घेटाने ज्यो पय जय-छे आओ जरीदाया-छता मांथी
[G3588](#) [G0190](#) [G3588](#) [G0721](#) [G3699](#) [G0302](#) [G5217](#) [G3778](#) [G0059](#) [G0575](#)

τῶν ἀνθρώπων ἀπαρχῆ τῷ Θεῷ, καὶ τῷ Ἄρνίῳ:
 आ माएसोमांथी प्रथमइत एश्वर-माटे एश्वरने अने ते घेटाने
[G3588](#) [G0444](#) [G0536](#) [G3588](#) [G2316](#) [G2532](#) [G3588](#) [G0721](#)

These are they that were not defiled with women; for they are virgins. These are they that follow the Lamb whithersoever he goeth. These were purchased from among men, to be the firstfruits unto God and unto the Lamb.

5 καὶ ἐν τῷ στόματι αὐτῶν οὐχ εὐρέθη ψεῦδος; ἄμωμοὶ εἰσιν {ἐνώπιον
 अने मां तेमना मोढामां तेमना नछोतुं मय्युं जूट्टे निर्दोष छे समक्ष
[G2532](#) [G1722](#) [G3588](#) [G4750](#) [G0846](#) [G3756](#) [G2147](#) [G5579](#) [G0299](#) [G1510](#) [G1799](#)

τοῦ θρόνου τοῦ Θεοῦ}.
 ते राज्यासनना ते एश्वरना
[G3588](#) [G2362](#) [G3588](#) [G2316](#)

And in their mouth was found no lie: they are without blemish.

6 Καὶ εἶδον ἄλλον ἄγγελον πετόμενον ἐν μεσουρανήματι, ἔχοντα εὐαγγέλιον
 अने म्-जेयुं बीजे छूत छसतो मां आकाशनी-वय्ये जेनी-पासे-छती सुवाती
[G2532](#) [G3708](#) [G0243](#) [G0032](#) [G4072](#) [G1722](#) [G3321](#) [G2192](#) [G2098](#)

αἰώνιον εὐαγγελίαι ἐπὶ τοῦς καθημένους ἐπὶ τῆς γῆς, καὶ ἐπὶ πάντων
 शाश्वत सुवाती-आपवा माटे जेओ बेटा-छे उपर आ पृथ्वीना अने माटे एरेक
[G0166](#) [G2097](#) [G1909](#) [G3588](#) [G2521](#) [G1909](#) [G3588](#) [G1093](#) [G2532](#) [G1909](#) [G3956](#)

ἔθνος, καὶ φυλῆν, καὶ γλῶσσαν, καὶ λαόν;
 प्रजा अने कुल अने भाषा अने लोक
[G1484](#) [G2532](#) [G5443](#) [G2532](#) [G1100](#) [G2532](#) [G2992](#)

And I saw another angel flying in mid heaven, having eternal good tidings to proclaim unto them that dwell on the earth, and unto every nation and tribe and tongue and people;

7 λέγων ἐν φωνῇ μεγάλῃ, Φοβήθητε τὸν Θεόν, καὶ δότε αὐτῷ δόξαν,
 कछेतां मां अवाजे मोटा डरो डरे एश्वरथी अने आपो तेने मछिमा
[G3004](#) [G1722](#) [G5456](#) [G3173](#) [G5399](#) [G3588](#) [G2316](#) [G2532](#) [G1325](#) [G0846](#) [G1391](#)

ὅτι ἦλθεν ἡ ὥρα τῆς κρίσεως αὐτοῦ; καὶ προσκυνήσατε τῷ ποιήσαντι
 कारश-डे आव्यो ते समय तेना त्थायनी तेनो अने अने लजना-करो तेने जेजे-बनाव्या
[G3754](#) [G2064](#) [G3588](#) [G5610](#) [G3588](#) [G2920](#) [G0846](#) [G2532](#) [G4352](#) [G3588](#) [G4160](#)

τὸν οὐρανὸν, καὶ τὴν γῆν, καὶ θάλασσαν, καὶ πηγὰς ὑδάτων.
 ते आकाश अने ते पृथ्वी अने समुद्र अने पाणीनां-जराया पाणीना
[G3588](#) [G3772](#) [G2532](#) [G3588](#) [G1093](#) [G2532](#) [G2281](#) [G2532](#) [G4077](#) [G5204](#)

and he saith with a great voice, Fear God, and give him glory; for the hour of his judgment is come: and worship him that made the heaven and the earth and sea and fountains of waters.

8 Καὶ ἄλλος, ἄγγελος □ δεύτερος ἠκολούθησεν, λέγων, Ἔπεσεν, ἔπεσεν Βαβυλῶν
 અને બીજો દૂત બીજો અનુસર્યો કહેતાં પડ્યું, પડ્યું બાબેલોન
[G2532](#) [G0243](#) [G0032](#) [G1208](#) [G0190](#) [G3004](#) [G4098](#) [G4098](#) [G0897](#)

ἡ μεγάλη; ἡ ἐκ τοῦ οἴνου τοῦ θυμοῦ τῆς πορνείας αὐτῆς,
 તે મહાનું; જેણે માંથી તે દ્રાક્ષારસનો તે ક્રોધનો તેની વ્યભિચારનો તેના
[G3588](#) [G3173](#) [G3739](#) [G1537](#) [G3588](#) [G3631](#) [G3588](#) [G2372](#) [G3588](#) [G4202](#) [G0846](#)

πεπότικεν πάντα τὰ ἔθνη.
 પાયો-હતો બધી તે પ્રજાઓને
[G4222](#) [G3956](#) [G3588](#) [G1484](#)

And another, a second angel, followed, saying, Fallen, fallen is Babylon the great, that hath made all the nations to drink of the wine of the wrath of her fornication.

9 Καὶ ἄλλος, ἄγγελος, τρίτος, ἠκολούθησεν αὐτοῖς, λέγων ἐν φωνῇ μεγάλῃ,
 અને બીજો દૂત ત્રીજો અનુસર્યો તેમને કહેતાં માં અવાજે મોટા
[G2532](#) [G0243](#) [G0032](#) [G5154](#) [G0190](#) [G0846](#) [G3004](#) [G1722](#) [G5456](#) [G3173](#)

Εἶ τις προσκυνεῖ τὸ θηρίον καὶ τὴν εἰκόνα αὐτοῦ, καὶ λαμβάνει
 જે કોઈ ભજના-કરે તે પશુની અને તેની મૂર્તિની તેની અને લે-છે
[G1487](#) [G5100](#) [G4352](#) [G3588](#) [G2342](#) [G2532](#) [G3588](#) [G1504](#) [G0846](#) [G2532](#) [G2983](#)

χάραγμα ἐπὶ τοῦ μετώπου αὐτοῦ, ἢ ἐπὶ τὴν χεῖρα αὐτοῦ,
 છાયા ઉપર તેના કપાલ તેના અથવા ઉપર તેની હાથ તેનો
[G5480](#) [G1909](#) [G3588](#) [G3359](#) [G0846](#) [G2228](#) [G1909](#) [G3588](#) [G5495](#) [G0846](#)

And another angel, a third, followed them, saying with a great voice, If any man worshippeth the beast and his image, and receiveth a mark on his forehead, or upon his hand,

10 καὶ αὐτὸς πίεται ἐκ τοῦ οἴνου τοῦ θυμοῦ τοῦ Θεοῦ, τοῦ
 તો તે પીશે માંથી તે દ્રાક્ષારસનો તે ક્રોધનો તે ἔશ્વરનો જે
[G2532](#) [G0846](#) [G4095](#) [G1537](#) [G3588](#) [G3631](#) [G3588](#) [G2372](#) [G3588](#) [G2316](#) [G3588](#)

κεκρασμένου ἀκράτου ἐν τῷ ποτηρίῳ τῆς ὀργῆς αὐτοῦ; καὶ
 મિશ્રિત-કરેલો ખાલસ માં તે પ્યાલામાં તેના ક્રોધના તેનો અને
[G2767](#) [G0194](#) [G1722](#) [G3588](#) [G4221](#) [G3588](#) [G3709](#) [G0846](#) [G2532](#)

βασανισθήσεται ἐν πυρὶ καὶ θείῳ, ἐνώπιον ἀγγέλων ἁγίων, καὶ ἐνώπιον
 યાતના-ભોગવશે માં અગ્નિ અને ગંધકથી સમક્ષ પવિત્ર-દૂતોના પવિત્રોન □ અને સમક્ષ
[G0928](#) [G1722](#) [G4442](#) [G2532](#) [G2303](#) [G1799](#) [G0032](#) [G0040](#) [G2532](#) [G1799](#)

τοῦ Ἄρνιου.
 તે ઘેટાન □
[G3588](#) [G0721](#)

he also shall drink of the wine of the wrath of God, which is prepared unmixed in the cup of his anger; and he shall be tormented with fire and brimstone in the presence of the holy angels, and in the presence of the Lamb:

11 καὶ ὁ καπνὸς τοῦ βασανισμοῦ αὐτῶν εἰς αἰῶνα αἰώνων ἀναβαίνει;
 અને તે ધૂમાડો તેમની યાતનાનો તેમનો માં યુગોના-યુગો યુગો ચઢે-છે
[G2532](#) [G3588](#) [G2586](#) [G3588](#) [G0929](#) [G0846](#) [G1519](#) [G0165](#) [G0165](#) [G0305](#)

καὶ οὐκ ἔχουσιν ἀνάπαυσιν, ἡμέρας καὶ νυκτός, οἱ προσκυνοῦντες τὸ
 અને નથી તેમને-મળે આરામ દિવસે અને રાતે જેઓ ભજના-કરે-છે તે
[G2532](#) [G3756](#) [G2192](#) [G0372](#) [G2250](#) [G2532](#) [G3571](#) [G3588](#) [G4352](#) [G3588](#)

θηρίον καὶ τὴν εἰκόνα αὐτοῦ, καὶ εἶ τις λαμβάνει τὸ χάραγμα τοῦ
 પશુની અને તેની મૂર્તિની તેની અને જો કોઈ લે-છે તે ઇપ તેન
[G2342](#) [G2532](#) [G3588](#) [G1504](#) [G0846](#) [G2532](#) [G1487](#) [G5100](#) [G2983](#) [G3588](#) [G5480](#) [G3588](#)

ὀνόματος αὐτοῦ.
 નામનો તેનો
[G3686](#) [G0846](#)

and the smoke of their torment goeth up for ever and ever; and they have no rest day and night, they that worship the beast and his image, and whoso receiveth the mark of his name.

12 Ὡδε ἡ ὑπομονὴ τῶν ἁγίων ἐστίν, οἱ τηροῦντες τὰς ἐντολὰς τοῦ
 અહીં તે ધીરજ તે સંતોની છે જેઓ પાળે-છે તે આજ્ઞાઓ ઈશ્વરની
[G5602](#) [G3588](#) [G5281](#) [G3588](#) [G0040](#) [G1510](#) [G3588](#) [G5083](#) [G3588](#) [G1785](#) [G3588](#)

Θεοῦ, καὶ τὴν πίστιν Ἰησοῦ.
 ઈશ્વરના અને તે વિશ્વાસ ઈસુનો
[G2316](#) [G2532](#) [G3588](#) [G4102](#) [G2424](#)

Here is the patience of the saints, they that keep the commandments of God, and the faith of Jesus.

13 Καὶ ἤκουσα φωνῆς ἐκ τοῦ οὐρανοῦ, λεγούσης Γράψον, Μακάριοι οἱ
 અને મેં-સાંભળ્યો અવાજ માંથી તે આકાશમાંથી કહેતો લખો ધન્ય તેઓ
[G2532](#) [G0191](#) [G5456](#) [G1537](#) [G3588](#) [G3772](#) [G3004](#) [G1125](#) [G3107](#) [G3588](#)

νεκροὶ οἱ ἐν Κυρίῳ ἀποθνήσκοντες ἀπ' ἄρτι. ναί, λέγει τὸ Πνεῦμα,
 મૃતક જેઓ માં પ્રભુમાં મરે-છે હવેથી અત્યારથી હા કહે-છે તે આત્મા
[G3498](#) [G3588](#) [G1722](#) [G2962](#) [G0599](#) [G0575](#) [G0737](#) [G3483](#) [G3004](#) [G3588](#) [G4151](#)

ἵνα ἀναπαήσονται ἐκ τῶν κόπων αὐτῶν; τὰ γὰρ ἔργα αὐτῶν ἀκολουθεῖ
 કે આરામ-પામશે માંથી તેમના પરિશ્રમનો તેમના તે ખરેખર કાર્યો તેમનાં અનુસરે-છે
[G2443](#) [G0373](#) [G1537](#) [G3588](#) [G2873](#) [G0846](#) [G3588](#) [G1063](#) [G2041](#) [G0846](#) [G0190](#)

μετ' αὐτῶν.
 સાથે તેમની
[G3326](#) [G0846](#)

And I heard a voice from heaven saying, Write, Blessed are the dead who die in the Lord from henceforth: yea, saith the Spirit, that they may rest from their labors; for their works follow with them.

14 Καὶ εἶδον, καὶ ἰδοὺ, νεφέλην λευκὴν, καὶ ἐπὶ τὴν νεφέλην καθήμενον
 અને મેં-જોયું અને જુઓ વાદળ શ્વેત અને ઉપર તે વાદળ-પર બેઠેલો
[G2532](#) [G3708](#) [G2532](#) [G3708](#) [G3507](#) [G3022](#) [G2532](#) [G1909](#) [G3588](#) [G3507](#) [G2521](#)

ὅμοιον υἱὸν ἀνθρώπου, ἔχων ἐπὶ τῆς κεφαλῆς αὐτοῦ στέφανον χρυσοῦν,
 સમાન પુત્ર માણસનો જેની-પાસે-હતો ઉપર તેનું માથાનું તેનો મુકુટ સોનાનો
[G3664](#) [G5207](#) [G0444](#) [G2192](#) [G1909](#) [G3588](#) [G2776](#) [G0846](#) [G4735](#) [G5552](#)

καὶ ἐν τῇ χειρὶ αὐτοῦ δρέπανον ὀξύ.
 અને માં તેના હાથમાં તેનો દાતરડો તીક્ષ્ણ
[G2532](#) [G1722](#) [G3588](#) [G5495](#) [G0846](#) [G1407](#) [G3691](#)

And I saw, and behold, a white cloud; and on the cloud I saw one sitting like unto a son of man, having on his head a golden crown, and in his hand a sharp sickle.

- 15 Καὶ ἄλλος ἄγγελος ἐξῆλθεν ἐκ τοῦ ναοῦ, κράζων ἐν φωνῇ μεγάλη
 અને બીજો દૂત નીકળ્યો માંથી તે મંદિરમાંથી બૂમો-પાડતાં માં અવાજે મોટા
[G2532](#) [G0243](#) [G0032](#) [G1831](#) [G1537](#) [G3588](#) [G3485](#) [G2896](#) [G1722](#) [G5456](#) [G3173](#)
- τῷ καθημένῳ ἐπὶ τῆς νεφέλης, Πέμψον τὸ δρέπανόν σου καὶ θέρισον;
 તેને બેઠેલાને ઉપર આ વાદળના મોકલો તારો દાતરડો તારો અને લણો
[G3588](#) [G2521](#) [G1909](#) [G3588](#) [G3507](#) [G3992](#) [G3588](#) [G1407](#) [G4771](#) [G2532](#) [G2325](#)
- ὅτι ἦλθεν ἡ ὥρα θερίσαι, ὅτι ἐξηράνθη ὁ θερισμὸς τῆς γῆς.
 કારણ-કે આવ્યો તે સમય કાપવાનો કારણ-કે સૂકાઈ-ગઈ તે કાપણી આ પૃથ્વીની
[G3754](#) [G2064](#) [G3588](#) [G5610](#) [G2325](#) [G3754](#) [G3583](#) [G3588](#) [G2326](#) [G3588](#) [G1093](#)

And another angel came out from the temple, crying with a great voice to him that sat on the cloud, Send forth thy sickle, and reap: for the hour to reap is come; for the harvest of the earth is ripe.

- 16 καὶ ἔβαλεν ὁ καθήμενος ἐπὶ τῆς νεφέλης, τὸ δρέπανον αὐτοῦ ἐπὶ
 અને નાખ્યો જે બેઠેલો-હતો ઉપર આ વાદળના તેનો દાતરડો તેનો ઉપર
[G2532](#) [G0906](#) [G3588](#) [G2521](#) [G1909](#) [G3588](#) [G3507](#) [G3588](#) [G1407](#) [G0846](#) [G1909](#)
- τὴν γῆν, καὶ ἐθερίσθη ἡ γῆ.
 આ પૃથ્વી-પર અને કાપી-ગઈ તે પૃથ્વી
[G3588](#) [G1093](#) [G2532](#) [G2325](#) [G3588](#) [G1093](#)

And he that sat on the cloud cast his sickle upon the earth; and the earth was reaped.

- 17 Καὶ ἄλλος ἄγγελος ἐξῆλθεν ἐκ τοῦ ναοῦ τοῦ ἐν τῷ οὐρανῷ,
 અને બીજો દૂત નીકળ્યો માંથી તે મંદિરમાંથી જે માં તે આকাশમાંનો
[G2532](#) [G0243](#) [G0032](#) [G1831](#) [G1537](#) [G3588](#) [G3485](#) [G3588](#) [G1722](#) [G3588](#) [G3772](#)
- ἔχων καὶ αὐτὸς δρέπανον ὀξύ.
 જે-ની-પાસે-હતો પણ તે દાતરડો તીક્ષણ
[G2192](#) [G2532](#) [G0846](#) [G1407](#) [G3691](#)

And another angel came out from the temple which is in heaven, he also having a sharp sickle.

- 18 Καὶ ἄλλος ἄγγελος ἐξῆλθεν ἐκ τοῦ θυσιαστηρίου, ὁ ἔχων ἐξουσίαν
 અને બીજો દૂત નીકળ્યો માંથી તે વેદીમાંથી જે જે-ની-પાસે-હતો અધિકાર
[G2532](#) [G0243](#) [G0032](#) [G1831](#) [G1537](#) [G3588](#) [G2379](#) [G3588](#) [G2192](#) [G1849](#)
- ἐπὶ τοῦ πυρός, καὶ ἐφώνησεν φωνῇ μεγάλῃ τῷ ἔχοντι τὸ
 ઉપર તે અગ્નિ-નો અને બોલાવ્યો અવાજે મોટા જે-ની-પાસે-હતો તેને તે
[G1909](#) [G3588](#) [G4442](#) [G2532](#) [G5455](#) [G5456](#) [G3173](#) [G3588](#) [G2192](#) [G3588](#)
- δρέπανον τὸ ὀξύ, λέγων, Πέμψον σου τὸ δρέπανον τὸ ὀξύ, καὶ
 દાતરડો તે તીક્ષણ કહેતાં મોકલો તારો તે દાતરડો તે તીક્ષણ અને
[G1407](#) [G3588](#) [G3691](#) [G3004](#) [G3992](#) [G4771](#) [G3588](#) [G1407](#) [G3588](#) [G3691](#) [G2532](#)
- τρύγησον τοὺς βότρυας τῆς ἀμπελίου τῆς γῆς; ὅτι ἦκμασαν αἱ
 વીણο તે દ્રાક્ષના-ગુચ્છા આ દ્રાક્ષવેલના આ પૃથ્વીના કારણ-કે પાકી-ગયાં તે-ની
[G5166](#) [G3588](#) [G1009](#) [G3588](#) [G0288](#) [G3588](#) [G1093](#) [G3754](#) [G0187](#) [G3588](#)
- σταφυλαὶ αὐτῆς.
 દ્રાક્ષો તે-ની
[G4718](#) [G0846](#)

And another angel came out from the altar, he that hath power over fire; and he called with a great voice to him that had the sharp sickle, saying, Send forth thy sharp sickle, and gather the clusters of the vine of the earth; for her grapes are fully ripe.

19 καὶ ἔβαλεν ὁ ἄγγελος τὸ δρέπανον αὐτοῦ εἰς τὴν γῆν, καὶ
 અને નાખ્યો ते हूते तेनो एतरडी तेनो मां आ पृथ्वी-पर अने
[G2532](#) [G0906](#) [G3588](#) [G0032](#) [G3588](#) [G1407](#) [G0846](#) [G1519](#) [G3588](#) [G1093](#) [G2532](#)
 ἐτρύγησεν τὴν ἄμπελον τῆς γῆς, καὶ ἔβαλεν εἰς τὴν ληνὸν τοῦ θυμοῦ
 वीण्यो आ द्राक्षवेदने आ पृथ्वीनी अने नाख्यो मां आ द्राक्षाङ्गुसमां ते क्रोधनो
[G5166](#) [G3588](#) [G0288](#) [G3588](#) [G1093](#) [G2532](#) [G0906](#) [G1519](#) [G3588](#) [G3025](#) [G3588](#) [G2372](#)
 τοῦ Θεοῦ τὸν μέγαν;
 ते ईश्वरनं ते मोटा
[G3588](#) [G2316](#) [G3588](#) [G3173](#)

And the angel cast his sickle into the earth, and gathered the vintage of the earth, and cast it into the winepress, the great winepress, of the wrath of God.

20 καὶ ἐπατήθη ἡ ληνὸς ἔξωθεν τῆς πόλεως, καὶ ἐξῆλθεν αἷμα ἐκ τῆς
 અને કચડायुं ते द्राक्षाङ्गुस बहार आ शहरनी अने नीकळुं बोळी मांथी आ
[G2532](#) [G3961](#) [G3588](#) [G3025](#) [G1855](#) [G3588](#) [G4172](#) [G2532](#) [G1831](#) [G0129](#) [G1537](#) [G3588](#)
 ληνοῦ, ἄχρι τῶν χαλινῶν τῶν ἵππων, ἀπὸ σταδίων χιλίων ἑξακοσίων.
 द्राक्षाङ्गुसमांथी सुधी ते घोडाओनी-लगाम ते घोडाओनी आशरे स्टेडिया छजार छसो
[G3025](#) [G0891](#) [G3588](#) [G5469](#) [G3588](#) [G2462](#) [G0575](#) [G4712](#) [G5507](#) [G1812](#)

And the winepress was trodden without the city, and there came out blood from the winepress, even unto the bridles of the horses, as far as a thousand and six hundred furlongs.